

મૂળ આત્મિક
ઉન્નતિનો લાભ
અરિહંતાદિ
નવપદના
ધ્યાનથી જ
થાય છે.



વાણી વિરમે,
વિચાર વિરમે
એટલે
આત્મધ્યાન
શરૂ થાય.



ઉત્તમ પુરુષોની
સાથે રહેવું
એને
જીવનનું
પરમ સૌભાગ્ય
કહ્યું છે.





તપ અને ક્રિયાના
ડાળી અને પાંદડાંને
ડોલો ભરીને
પાણી પાયું,
હવે કમ સે કમ
એના મૂળ એવા
જ્ઞાનને
એકાદ લોટો
પાણી તો સિંચીએ !





ઘણું કરવું છે
એવી રેસમાં
જવા કરતાં,
"જે કરીએ તે
ઉત્તમ કરીએ"

તેની

મથામણમાં રહેવું
વધુ હિતાવહ છે.



કોઈ પણ જીવની
જીભ દ્વારા
અવર્ણવાદ (નિંદા)
ન કરવા પૂર્વક પણ
અરિહંત
પદની આરાધના
કરી શકાય
એ સમજાય છે ?



પરસ્પર
પ્રમોદપૂર્ણ
પ્રીતિભાવ
એ
જ્ઞાન-સાધનાનો
પરિપાક છે.



કેટલાક માણસો
જ્યાં જાય ત્યાં
આનંદ થાય,
કેટલાક
જ્યાંથી જાય ત્યાં
આનંદ થાય.
આપણો નંબર
શેમાં ?



કોઈ પણ જીવને
તરત ના પાડીએ
તો મૈત્રીનો
સેતુ નથી
એમ નક્કી થાય.
મૈત્રી તો રાખવાની
છે તો ના કેમ
તરત પડાય ?





અભંગદ્વાર
પાઠશાળા

આ જીવનનું સાફલ્ય
એક ક્ષણ
માટેની પણ
આત્માનુભૂતિ થાય
તેમાં છે અને
તે માટે તપ,
તે માટે જપ,
તે માટે પૂજા,
તે માટે સેવા.



જીવનમાં કોઈએ
પોતાના પર
કરેલો ઉપકાર હોય
તો તેને વારંવાર
વિશેષ કરીને
યાદ કરવો
એ આપણી પાત્રતાને
વિકસાવનારું
તત્ત્વ છે.



પરિવારના
સર્વ સભ્યો
અરસપરસના
સંપ, સ્નેહ ને
હુંફથી
છલકાતા હોય
તે ધર્મી પરિવારની
નિશાની છે.



પ્રાતઃકાળ,
મધ્યાહ્ન અને
સાયંકાળ એમ
ત્રણેય સમયની
ભક્તિથી
સ્મૃતિ લાભ,
શક્તિ લાભ અને
શાન્તિ લાભ
થાય છે.



હે પ્રભુ !
અમારા કામો
આપની ઈચ્છા
મુજબ થાઓ.
અમારી ઈચ્છાનો
લય થાઓ,
તમારી ઈચ્છાનો
જય થાઓ.



પરિવારમાં
સ્નેહની વૃદ્ધિ માટે
પોતાનાથી મોટાની
ભૂલ હોય તો
આદર ભાવે
નોંધ ન લેવી અને
પોતાનાથી નાનાની
ભૂલ હોય તો
સ્નેહથી ભૂલી જવી.

